

સરકારી સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય ફેકલ્ટીના જ્ઞાનનો લાભ મળશે

નવગુજરાત સમય > અમદાવાદ

મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટની ગ્લોબલ ઈનિશિયેટિવ ઓફ એકેડેમિક નેટવર્ક (GIAN) નિમિત્તે આઈઆઈટી ગાંધીનગર ખાતે એચઆરડી મંત્રી સ્મૃતિ ઈરાની ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામને કારણે વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ એકબીજા સાથે નેટવર્કિંગ કરી શકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આઈઆઈટી ઉપરાંત અનેક સરકારી સંસ્થાઓને પણ GIANના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી પાસેથી શીખવાની તક મળશે.

આ પ્રસંગે સ્મૃતિ ઈરાનીએ થ્રીડી ડિજિટાઈઝેશન અને કલચરલ હેરિટેજ તથા ઓર્થોપેડિક બાયોમિકેનિક્સ વગેરે ૧૦ દિવસના ગાળાના કોર્સની ઘોષણા કરી હતી. GIAN દ્વારા આવા ૨૦૧ બીજા કોર્સ એપ્રુવ કરવામાં આવ્યા છે. આ પ્રોગ્રામમાં આ વર્ષે ૫૦૦ અને આવનારા વર્ષોમાં ૧૦૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી લેક્ચર લેશે અને તેના માટે મિનિસ્ટ્રી દ્વારા ₹૩૫ કરોડનું ફંડ ફાળવાયું છે. દેશની ૫૦૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ GIANનો ભાગ બનશે.